

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૪/૨૦૧૫ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર
નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૮૩૨/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૫ કેસ કરી ૨૭ વ્યક્તિઓને ઝડપી, ૨૨૭ લીટર દેશી દારૂ, ૨૪ બિયર ટીન અને ૦૨ એક્ટીવા સ્કુટર કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૧ કેસ કરી ૦૧ વ્યક્તિને ઝડપી રોકડ રૂપિયા ૨૭૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૩૩/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી. ૯૩ મુજબ ૦૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૮૩૪/૧૫

સરખેજ : મધુબેન તે વિનોદભાઈ ભવાનભાઈ ચૌહાણની વિધવા પત્ની (રહે. ચામુંડા નગર, સરખેજ) એ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૪/૧૫ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીકથી પોતાનો પુત્ર ઉમંગ (ઉ.વ.૧૬) ટ્યુશને જવા એક્ટીવા નંબર જીજે.૦૧.એસ.ટી. ૬૪૯૧ લઈ નિકળેલ, જેને કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ શ્રી વી.એન.સોલંકી ચલાવે છે.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૩૫/૧૫

આનંદનગર : ગુલાબભાઈ ઉસમાનભાઈ મીર (રહે: નુરે મોહંમદ સોસાયટીની પાછળ, રહીમનગર, જુના જંકશન રોડ, તા:વઢવાણ, જી સુરેન્દ્રનગર) એ તા.૨૫/૪/૧૫ નારોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આરોપી સુરેશ પલાભાઈ ઠાકોર (રહે, થલતેજ પાણીની ટાંકી પાસે, શાકમાર્કેટની બાજુમાં, થલતેજ) ને ભાડુ રૂપિયા ૧,૦૦૦/- નક્કી કરી, તા.૧૨/૪/૧૫ બપોરનાં ૧/૩૦ થી ૨/૦૦ વાગ્યા દરમિયાન સુરેન્દ્રનગર થી અમદાવાદ રોઝવુડ ચાર રસ્તા પાસે, ગોપાલ શોપીંગ સેન્ટર આગળ આવેલ સિધ્ધી જ્વેલર્સ ખાતે પોતાની રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ગુલાબભાઈને વિશ્વાસમાં લઈ ભાડાનાં રૂપિયા ૧૦૦૦/- સંબંધીને ત્યાંથી લઈને આવુ છુ તેમ કહી ગુલાબભાઈની રીક્ષા લઈ નાસી જઈ ગુલાબભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.ડી.ડીકોર ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૮૩૬/૧૫

બાપુનગર : નટવરભાઈ સોમાભાઈ મકવાણા (રહે.ગુ.હા.બોર્ડ, કલ્યાણ કેન્દ્રની સામે, બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૪/૧૫ રાતના ૧૧/૩૦ થી તા.૨૫/૪/૧૫ સવારના ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી રસોડામાં પડેલ લાકડાના કબાટનો નકૂચો તોડી, કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૮૯,૭૫૦/- અને રોકડા રૂપિયા ૮,૦૦૦/- મળી કુલ રૂપિયા ૯૭,૭૫૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી આર.આર.વસાવા ચલાવે છે.

નારણપુરા : ભરતભાઈ સુમતીલાલ ભોજક (રહે.શાંતિનગર સોસાયટી, ઉસ્માનપુરા) એ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૪/૧૫ ના કલાક ૮/૦૦ થી તા.૨૫/૪/૧૫ બપોરના ૨/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના રસોડાની ગ્રીલ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા ૫૦,૦૦૦/- તથા ચાંદીનો સિક્કો તેમજ કાનમાં પહેરવાની સોનાની વાળી કિંમત રૂપિયા ૫,૦૦૦/-, બે સોનાના સેટ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- તેમજ ભરતભાઈની પડોશમાં રહેતા નીકેશભાઈ મોતીલાલ નાઓના ઘરની પણ બારીની ગ્રીલ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, એક સેમસંગ કંપનીનું એલ.સી.ડી ટી.વી. કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૫,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એચ.ખરસાણ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૮૩૭/૧૫

નવરંગપુરા : અશોકકુમાર નેરુકોન્ડા કેપીયાર (રહે.અવન્ટી ફ્લેટ, સરકીટ હાઉસ પાસે, શાહીબાગ) એ તા.૨૪/૪/૧૫ સવારના ૧૦/૦૦ વાગે સ્ટેડીયમ પાંચ રસ્તા, એસ.બી.આઇ.કોર્પોરેટ શાખા નીચે પાર્કિંગમાં પોતાની મારૂતી ૮૦૦ કાર નંબર જીજે.૦૬.સી.એમ.૦૫૨૯ કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી બપોરનાં ૧/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ અશોકકુમાર કેપીયારે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.કે.ગૌસ્વામી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૩૮/૧૫

સાબરમતી : પ્રકાશભાઈ સોમાભાઈ મકવાણા (ઉ.વ.૨૧)(રહે.નિત્યનગર-૧, ગાંધીવાસની પાસે, મોટેરા રોડ, સાબરમતી) એ કોઈ કારણસર તા.૨૧/૪/૧૫ રાતનાં ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઉઘઘ મારવાની દવા પી જતાં સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૫/૪/૧૫ નાં કલાક ૩/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમેશભાઈ બિજલભાઈ ચલાવે છે.

(ઇ.યા.)નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.